



બ્રમ્પટન ટ્રાન્ઝિટ સર્વિસમાં COVID-19 સામે પ્રતિક્રિયા કરવામાં ફેબ્રુઆરી 28 થી અમલી બનતા ફેરફારો

બ્રમ્પટન, ઓન્ટેરિયો (ફેબ્રુઆરી 22, 2022) – આપણી ટ્રાન્ઝિટ સિસ્ટમ શહેરની આસપાસ લોકોને કાર્યક્ષમ રીતે હેરફેર કરાવવાનું ચાલુ હોવાની ખાતરી કરાવવા, બ્રમ્પટન ટ્રાન્ઝિટ સોમવાર, ફેબ્રુઆરી 28, 2022 થી સર્વિસમાં નીચેના ફેરફારો અમલમાં મૂકશે.

નીચેના રૂટ્સની સર્વિસ ફરી ચાલુ થશે, અને સુધારેલા સર્વિસ સ્તરો સાથે કાર્યરત થશે:

- 12 ગ્રેનોબલ
- 13 એવોનડેલ
- 16 સાઉથગેટ
- 17 હાઉડન
- 19 ફર્નફિલ્ડ
- 25 એડેનબ્રૂક
- 28 વાનવેસ
- 40 સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ
- 55 એલબર્ન માર્કેલ
- 81 મેફિલ્ડ વેસ્ટ

નીચે જણાવેલા રૂટ્સ પૂર્ણ સર્વિસ સ્તરો સાથે ફરીથી શરૂ થશે:

- 505 ઝુમ બોવાડે)
- 511C ઝુમ સ્ટીલ્સ
- 2 મેઈન
- 3 મેકલાફલન
- 4 ટિંગકુસી
- 15 બ્રેમલી
- 18 ડિક્સી
- 199 UTM એક્સપ્રેસ

નોંધ: ઉપરના ફેરફારો જાન્યુઆરી, 2022 ની શરૂઆતમાં અમલમાં હતા તે સમયપત્રકો સુધી સર્વિસ સ્તરોને ફરીથી સ્થાપિત કરે છે

નીચેના રૂટ્સ આગળ નોટિસ આપતા સુધી રદ રહે છે (વીકેડેઝ અને વીકએન્ડ્સ સહિત):

- 501A/ 501C ઝુમ ક્વીન
- 561 ઝુમ ક્વીન વેસ્ટ
- 18B ડિક્સી (18 ડિક્સી હજુ પણ કાર્યરત છે)
- 21 હાર્ટ લેક
- 36 ગાર્ડનબ્રૂક (સ્કૂલના માત્ર વધારાની ટ્રિપ્સ (ફેરા) ચાલુ)
- 58 ફાઈનાન્સિયલ ડ્રાઈવ
- 65 સીનિયર્સ શોપર
- 92 બ્રેમલી GO
- 104 ટિંગકુસી એક્સપ્રેસ
- 185 ડિક્સી એક્સપ્રેસ



સમયપત્રકમાં ફેરફારો અને રૂટની માહિતીની સંપૂર્ણ યાદી માટે, [અહીં ક્લિક કરો](#).

તમારી આગામી ટ્રિપનું આયોજન કરવા, બ્રેમ્પટન ટ્રાન્ઝિટ કોન્ટેક્ટ સેન્ટરનો સંપર્ક 905.874.2999 નંબર પર કરો.

સંસાધનની ઉપલબ્ધતા અને સવારીઓની સંખ્યા (રાઈડરશિપ) પર દેખરેખ ચાલુ રહેશે અને બ્રેમ્પટન ટ્રાન્ઝિટ વધુ સર્વિસીસ વહેલામાં વહેલી તકે ફરીથી સ્થાપિત કરશે.

ઉતારુઓને ટ્રાન્ઝિટ સ્ટોપ્સ અને ટ્રાન્ઝિટમાં સુરક્ષિત રહેવાની અને અન્ય લોકોને સુરક્ષિત રહેવામાં મદદરૂપ થવાની યાદ અપાવવામાં આવે છે:

- તમારું મોઢું, દાઢી અને નાક બધાં સમયે ઢાંકતો મારસ્ક યોગ્ય રીતે પહેરવો.
- હેન્ડ સેનિટાઈઝર સાથે રાખવું અને તમારા હાથ વારંવાર ધોતા રહેવું.
- વ્યક્તિઓ વચ્ચે ભૌતિક અંતર શક્ય એટલું વધારે જાળવવાનો મહાવરો કરવો.

આપણાં ઉતારુઓ અને કર્મચારીઓનું આરોગ્ય અને સુરક્ષા ટોચની અગ્રતા ધરાવે છે. સીટી ઓફ બ્રેમ્પટન જોખમો પર દેખરેખ ચાલુ રાખવા પીલ પબ્લિક હેલ્થ, ગવર્નમેન્ટ ઓફ ઓન્ટેરિયો, અને બ્રેમ્પટન ઈમરજન્સી મેનેજમેન્ટ ઓફિસમાં પોતાના ભાગીદારો સાથે ઘનિષ્ટપણે કામ કરી રહ્યું છે.

અદ્યતન માહિતી નિયમિત મેળવવા વેબસાઈટ www.brampton.ca/COVID19 અને www.bramptontransit.com જોતા રહો અથવા સર્વિસ અપડેટ્સ માટે Twitter પર [@bramptontransit](https://twitter.com/bramptontransit) ને અનુસરો. કોઈ પ્રશ્નો સીધા બ્રેમ્પટન ટ્રાન્ઝિટના સંપર્ક કેન્દ્રને 905.874.2999 નંબર પર પૂછી શકાય છે.

-30-

મીડિયા સંપર્ક (MEDIA CONTACT)

સીટી ઓફ બ્રેમ્પટન મલ્ટીકલ્ચરલ મીડિયા

multiculturalmedia@brampton.ca